

જેનો મને અનુભવ થઈ રહ્યો છે તે શોષણ છે

શોષણ તે શક્તિ અને નિયંત્રણ પર આધારિત છે. તે ભાવનાત્મક, નાણાકીય, માનસિક, ડિજીટલ, શારીરિક અથવા જાતીય હોઈ શકે છે. ઉદાહરણો છે ગાળ દેવી, તમારા લોકેશનનું અનિચ્છનીય કોન્ટેક્ટ ટ્રેકિંગ કરવું અને નાણાકીય નિયંત્રણ કરવું.

24/7 મદદ ઉપલબ્ધ છે! જો તમારી જાણમાં એવું કોઈ હોય જેનું શોષણ થતું હોય તો **905-568-1068** પર વિક્ટિમ સર્વિસિસ ઓફ પીલ ને કૉલ કરવો.

peelregion.ca/BreakTheSilence

આ અભિયાનનો વિકાસ કમ્યુનિટી પાર્ટનરોના સહયોગ સાથે થયેલ છે.

 **Peel Region** csw@peel



HUM-1107-01 25/11